

અરજી કરવાની પ્રક્રિયા :

નીચેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ અરજી માન્ય થશે જે ધ્યાનમાં રાખવું

સ્ટેપ ૧:- અરજદારે <http://www.kcg.gujarat.gov.in> વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સ્ટેપ ૨:- અરજીપત્રકની સંપૂર્ણ વિગતો ભરી અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.

અરજીપત્રક સાથે જોડવાના પુરાવાની યાદી

- આધાર કાર્ડની કોપી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઓળખપત્ર અને રહેઠાણના પુરાવાની કોપી
- ધોરણ ૧૨ની માર્કશીટની કોપી
- સ્નાતક/અનુસ્નાતકની માર્કશીટ અને ડીગ્રી સર્ટિફિકેટની કોપી(જો કોઈ હોય તો)
- ફી ભર્યાની પહોંચ
- યુનિવર્સિટીનો એડમીશન પત્ર
- લોન એપ્લીકેશન ફોર્મની કોપી
- લોન પાસ થયાનું પ્રમાણપત્ર
- બેંકમાં આપેલ ડોક્યુમેન્ટની કોપી
- બેંકની પાસબુકના પ્રથમ પાનાની કોપી
- કેન્સલ ચેક
- ઇન્કમેટેક્સ રીટર્નની કોપી
- આવકનું સર્ટિફિકેટ મામલતદાર/ટીડીઓ દ્વારા
- ઇન્કમેટેક્સને પાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (જો ઇન્કમેટેક્સ રીટર્ન ભરતા ન હોય તો)
- ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

સ્ટેપ ૩: - અરજદારે અરજીપત્રકની પ્રિન્ટ લઈ અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજો તથા ઇન્કમેટેક્સને પાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (જો ઇન્કમેટેક્સ રીટર્ન ભરતા ન હોય તો) તથા ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શિડયુલ બેંકમાં જમા કરવાના રહેશે.

સ્ટેપ ૪:- ત્યારબાદ શિડયુલ બેંક દ્વારા અરજીપત્રક જરૂરી એન્ડોર્સમેન્ટ, બેંક લોન અને વ્યાજની વિગતો ભરીને કેસીજી કચેરીએ મોકલવાનું રહેશે.

તા.૩૧/૧૨/૨૦૧૭, ૧૮:૦૦ કલાક બાદ કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ તેમજ ધ્યાને લેવામાં આવશે નહિ તેની નોંધ લેવી.

ઉમેદવારને અરજીપત્રક ભરવામાં કે અન્ય કોઇ તકલીફ પડે તો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૩૦૨૦૬૭ અને Email ID:- isel.kcg@gmail.com પર સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી સંપર્ક કરી શકશે.